

M.Com.(New) Semester - 2 (CBCS) Examination
April/May-2023 (NEW COURSE)
Corporate Financial Reporting(CORECOURSE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ પરેશ લિ. નાં પાકા સરવૈયા નીચે આપેલ છે. સમાન કદના નાણાકીય પત્રકની ટેકનિકની મદદથી નાણાકીય આર્થિક સ્થિતિ વિશે વિવેચન કરો. (૨૦)

જવાબદારીઓ	31-03-2021 રૂપિયા	31-03-2022 રૂપિયા	મિલકતો	31-03-2021 રૂપિયા	31-03-2022 રૂપિયા
ઇક્વિટી શેરમૂડી	5,00,000	10,00,000	કાયમી મિલકતો	4,00,000	10,00,000
પ્રેફરન્સ શેરમૂડી	1,00,000	2,00,000	રોકાણો	3,00,000	1,00,000
સામાન્ય અનામત	1,00,000	2,50,000	દેવાદારો	2,00,000	4,00,000
નફા-નુકસાન ખાતું	2,00,000	3,00,000	આખર સ્ટોક	1,00,000	4,00,000
લેણદારો	1,00,000	2,00,000	રોકડ	50,000	1,00,000
ચુકવવાના બાકી ખર્ચા	50,000	50,000			
	10,50,000	20,00,000		10,50,000	20,00,000

અથવા

પ્રશ્ન.૧ નીચેની વિગતોમાંથી તા.31-03-2022 નાં રોજનું મહેશ લિમિટેડનું પાકુ સરવૈયુ તૈયાર કરો.

- | | |
|--|--------------|
| 1. ચોખ્ખી કાર્યશીલ મૂડી | રૂ. 6,00,000 |
| 2. ચાલુ ગુણોત્તર | 2.5 |
| 3. પ્રવાહી ગુણોત્તર | 1.5 |
| 4. કાચા નફાનો ગુણોત્તર | 20% |
| 5. સ્ટોક ચલનદર (વેચેલ માલની પડતર/આખર માલ) | 6 વખત |
| 6. કાયમી મિલકતોના ઉથલાનો ગુણોત્તર (વેચેલ માલની પડતર) | 2 વખત |
| 7. દેવાદાર ગુણોત્તર | 2 મહિના |
| 8. કાયમી મિલકતો સાથે શેરહોલ્ડર્સના ભંડોળનું પ્રમાણ | 0.80 |
| 9. અનામત અને વધારા સાથે શેરમૂડીનું પ્રમાણ | 50% |
| 10. લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડર્સના ભંડોળનું પ્રમાણ | 20% |

પ્રશ્ન.૨ તા.01-01-2022 ના રોજ રમેશ કંપની લિમિટેડનું પાકુ સરવૈયુ અને તા.31-12-2022 ના રોજ પૂરા થતા વર્ષનું આવકનું પત્રક નીચે મુજબ છે. (૨૦)

તા.01-01-2022 ના રોજનું પાકુ સરવૈયુ

જવાબદારીઓ	રકમ રૂ.	મિલકતો	રકમ રૂ.
શેરમૂડી	1,00,000	મશીનરી	88,000
12% ડિબેન્ચર	20,000	સ્ટોક	12,000
લેણદારો	20,000	દેવાદારો	20,000
		રોકડ	20,000
	1,40,000		1,40,000

તા.31-12-2022 નાં રોજ પૂરા થતા વર્ષનું આવકનું પત્રક

વિગત	રૂપિયા	કુલ રૂપિયા
વેચાણ		1,60,000
બાદ : વેચેલ માલની પડતર : શરૂનો સ્ટોક (FIFO)	12,000	
ખરીદી (ચોખ્ખી)	48,000	
	60,000	
બાદ : આખર સ્ટોક (FIFO)	-10,000	50,000
કાચો નફો		1,10,000
બાદ : વહીવટી ખર્ચા	24,000	
ઘસારો	8,800	
ડિબેન્ચર વ્યાજ (31-12-2022 નાં રોજનું ચુકવાયું)	2,400	-35,200
ચોખ્ખી આવક		74,800

વર્ષ દરમિયાન દેવાદારો અને લેણદારોની બાકી એકસરખી રહે છે.

સામાન્ય ભાવ સૂચક આંકો : તા.01-01-2022 વર્ષ દરમિયાન તા.31-12-2022

280

350

420

વર્તમાન ખરીદશક્તિની પદ્ધતિ(CPP) મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૨ નીચેની માહિતિને આધારે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ(CCA) હેઠળ ગિયરીંગ હવાલાની ગણતરી કરો.

વિગતો	01-04-2021 (રૂ.)	31-03-2022 (રૂ.)
રૂપાંતરપાત્ર ડિબેન્ચરો	10,00,000	12,00,000
બેંક ઓવરડ્રાફ્ટ	6,00,000	8,00,000
રોકડ	1,00,000	3,00,000
ભરપાઈ થયેલી શેરમૂડી	15,00,000	20,00,000
અનામતો	5,00,000	8,00,000

1. વેચાણ પડતરનો હવાલો (COSA) રૂ. 2,00,000

2. નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો (MWCA) રૂ. 1,50,000

3. ઘસારો રૂ. 50,000

કુલ રૂ. 4,00,000

પ્રશ્ન.૩ રાકેશ કંપનીના નીચેના આવક-ખર્ચ પત્રક પરથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(૧૫)

વિગત	રકમ રૂપિયા
વેચાણ	50,00,000
બાદ : માલસામાનની પડતર (વેચાણનાં %) 30%	
મજૂરીની પડતર (વેચાણનાં %) 20%	
સેવાની ખરીદી (વેચાણનાં %) 10%	
ઘસારો (વેચાણનાં %) 10%	
વ્યાજ (વેચાણનાં %) 10%	
કુલ 80%	40,00,000
કરવેરા પહેલાનો નફો	10,00,000
બાદ : કરવેરાની જોગવાઈ 60%	6,00,000
કરવેરા પછીનો નફો	4,00,000
બાદ : ડિવિડન્ડ ચૂકવેલ	3,00,000
રાખી મૂકેલ કમાણી	1,00,000

- પ્રશ્ન.૩ (A) આર્થિક મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. (૦૮)
 (B) બજાર મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ સમજાવો. (૦૭)
- પ્રશ્ન.૪ કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણનું મહત્વ જણાવો. (૧૫)

અથવા

- પ્રશ્ન.૪ કંપનીલક્ષી નાણાકીય અહેવાલપ્રેષણ એટલે શું? તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો.

ENGLISH VERSION

- Que.1** The balance sheet of Paresh Ltd. are given as under. Interpret financial economical position with the help of the technique of common size financial statement: (20)

Liabilities	31-03-2021 Rs.	31-03-2022 Rs.	Assets	31-03-2021 Rs.	31-03-2022 Rs.
Equity share capital	5,00,000	10,00,000	Fixed assets	4,00,000	10,00,000
Preference share capital	1,00,000	2,00,000	Investment	3,00,000	1,00,000
General reserve	1,00,000	2,50,000	Debtors	2,00,000	4,00,000
Profit and loss account	2,00,000	3,00,000	Closing stock	1,00,000	4,00,000
Creditors	1,00,000	2,00,000	Cash	50,000	1,00,000
Outstanding expenses	50,000	50,000			
	10,50,000	20,00,000		10,50,000	20,00,000

OR

- Que.1** From the following particulars, prepare the balance sheet of Mahesh Ltd. as on 31-03-2022.

- Net working capital **Rs. 6,00,000**
- Current ratio **2.5**
- Liquid ratio **1.5**
- Gross profit ratio **20%**
- Stock turnover ratio (cost of goods sold/closing stock) **6 times**
- Fixed assets turnover ratio (cost of goods sold) **2 times**
- Debtors ratio **2 months**
- Fixed assets to shareholder's fund **0.80**
- Reserves and surplus to share capital **50%**
- Long term loan to shareholders fund **20%**

- Que.2** The balance sheet as on 1-1-2022 and income statement for the year ending on 31-12-2022 of Ramesh limited are as follows: (20)

Balance sheet as on Dt. 1-1-2022

Liabilities	Rs.	Assets	Rs.
Share capital	1,00,000	Machinery	88,000
12% debenture	20,000	Stock	12,000
Creditors	20,000	Debtors	20,000
		Cash	20,000
	1,40,000		1,40,000

Income statement for the year ending 31-12-2022

Particulars	Rs.	Total Rs.
Sales	-	1.60.000
Less: Cost of sales:		
Opening stock (FIFO)	12,000	
Purchase (Net)	48,000	
	60,000	
Less: Closing stock (FIFO)	-10,000	50,000
Gross profit		1,10,000
Less: Administrative expenses	24,000	
Depreciation	8,800	
Debenture Interest (Paid on as 31-12-2022)	2,400	-35,200
Net Income		74,800

Balance of debtors and creditors A/C Remains uniform throughout the year.
General Price Index: On Dt.01-01-2022 280 For the year 350 On Dt.31-12-2022 420

Prepare final accounts by current purchase power method (CPP)

OR

Que.2 From the data given below calculate the gearing adjustment required under current cost accounting (CCA) Method: (20)

Particular	01-04-2021 RS.	31-03-2022 RS.
Convertible debentures	10,00,000	12,00,000
Bank overdraft	6,00,000	8,00,000
Cash	1,00,000	3,00,000
Paid-up share capital	15,00,000	20,00,000
Reserves	5,00,000	8,00,000

- 1) Cost of Sales Adjustment (COSA) Rs. 2,00,000
 - 2) Monetary Working Capital Adjustment Rs. 1,50,000
 - 3) Depreciation Rs. 50,000
- Total Rs. 4,00,000

Que.3 From income – expense statement of Rakesh company. Prepare valued added statement. (15)

Particular	Rs.
Sales	50,00,000
Less: Cost of materials (On Sale %) 30%	
Wages Cost (On Sale %) 20%	
Purchase of Service (On Sale %) 10%	
Depreciation (On Sale %) 10%	
Interest (On Sale %) <u>10%</u>	
Total 80%	40,00,000
Profit Before Tax	10,00,000
Less: Tax Provision 60%	6,00,000
Profit After Tax	4,00,000
Less: Dividend Paid	3,00,000
Retained Earning	1,00,000

OR

Que.3 (A) Explain the Concept of Economics value Added. (08)

(B) Explain the Concept of Market value Added. (07)

Que.4 Explain the Importance of Corporate Financial Reporting. (15)

OR

Que.4 What is corporate financial reporting? Explain Its Characteristics.
